

## PM-Kisan: Over ₹38k cr transferred during Apr-Aug

PRESS TRUST OF INDIA  
New Delhi, September 15

THE CENTRE HAS transferred ₹38,282 crore to farmers under PM-Kisan till August this fiscal, agriculture minister Narendra Singh Tomar informed the Lok Sabha on Tuesday. There is no proposal to either advance the payment of the remaining installments or increase the amount from the current level, he added.

Under the Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PM-KISAN), the government is providing ₹6,000 per annum in three equal installments to 14 crore farmers. The amount is directly transferred into the bank

accounts of the beneficiaries through the direct benefit transfer (DBT) mode.

Responding to a series of queries raised by MPs on this initiative, Tomar said an amount of ₹38,282 crore has been transferred to various beneficiaries under the scheme during April-August period of this fiscal. "Around 9.24 crore farmer families have been benefited under the PM-KISAN Scheme," he said, adding there is no proposal for advance payment of the remaining installments for the 2020-21 fiscal.

There is also no proposal to increase the amount from the current level to ₹12,000 annually, he added.

Sugar mills owe ₹13k cr to farmers for 2019-20 season as on Sept 11

SUGAR MILLS OWED nearly ₹13,000 crore to cane farmers as on September 11 for the 2019-20 marketing season, starting October 2019.

"Out of total cane dues of ₹75,585 crore for 2019-20 as on September 11, 2020, about ₹62,591 crore have been paid to the sugarcane farmers & only ₹12,994 crore cane dues are yet to be paid," MoS for food and consumer affairs Danve Raosaheb Dadarao said in the Lok Sabha.

The sugar mills also owe ₹548 crore for 2018-19 marketing season (October-September), ₹242 crore for 2017-18 and ₹1,899 crore for 2016-17 and earlier, taking the total outstanding amount to ₹15,683 crore. — PTI

## Delay in green clearances curbing not only new projects but expansion too, says dyestuff makers association

FE BUREAU  
Ahmedabad, September 15

DESPITE REPEATED CLAIMS related to 'ease of doing business' from Gujarat government, new industrial projects are facing unnecessary delays in availing various permissions including that of environment clearances.

Raising the issue of delay in permissions Gujarat Dyestuff Manufacturer Association (GDMA) claimed that due to delay in permissions, not only new projects but expansions of many dyestuff units have been on hold.

"We have appealed to the

state government to grant all permissions related to new industrial units within the period of three months. Currently many greenfield projects including that of dyestuff are facing difficulties to start production due to delay in various permissions, especially environment related permissions," said Yogesh Parikh, president, GDMA.

To get permission for land fill site to dispose industrial solid waste, it is mandatory to avail environment clearance certificate after public hearing from the forest & environment department. But dyestuff units are not getting permissions despite fulfilment of all condi-

tions. GDMA has demanded that to avoid such situation Gujarat Industrial Development Corporation (GIDC) should be authorized to issue notification for solid waste disposal sites after verification of land.

GDMA has also demanded for 100 acres of non-agriculture land from the state government for the purpose near the industrial areas in Vapi, Dahej, Ankleshwar, Ahmedabad and Vadodara.

According to GDMA if proper infrastructure for solid waste disposal would

be developed, not only new industrial projects but many existing units would pump in fresh investments. As a result, not only state government's revenue would increase but a plethora of employment opportunities will also be generated, said GDMA in its representation to Gujarat Chief Minister.

The association has also demanded to reduce natural gas prices being provided to the chemical and dyestuff industry.

According to Parikh current prices are too high and if prices would reduce, local dyestuff and chemical units will be able to compete globally. Gujarat government has decided to lay a deep sea pipeline for the disposal of industrial waste water. For the purpose, the government will charge 30% of the total cost from beneficiary units. Looking at the current Covid-19 situation, this charge should be taken in instalment, he adds.

## Gujarat to set up world's 1st CNG terminal at Saurashtra region

FE BUREAU  
Ahmedabad, September 15

THE GUJARAT GOVERNMENT on Tuesday issued a letter of intent to set up the world's first compressed natural gas (CNG) terminal at Bhavnagar port in Saurashtra region.

The state government said that a consortium consisting Foresight Group of UK, Mumbai-based Padmanabh Mafatal Group and Boskalis group of the Netherlands are authorised to develop CNG port terminal at Bhavnagar.

In the first phase the developers would invest ₹1,300 crore for the 1.5 million metric tonne per annum (MMTPA) of CNG handling capacity. Sources in the Chief Minister's Office (CMO) said that the developers will also construct a Roll-in-Roll out (Ro-Ro) terminal, liquid cargo terminal and container terminal at Bhavnagar port.

"As of now, the total investment for the project approved by is around ₹2,000 crore. A MoU was signed for this ambitious project between Gujarat Maritime Board (GMB) and Foresight Group during the Vibrant Gujarat Summit held in January 2019," said a senior official in the state port & transport department.

Currently, the existing port at Bhavnagar is having a capacity to handle 3 MMTPA cargo, said the official, adding that after the construction of CNG port terminal and other facilities it would enhance to nine MMTPA.

According to him, major modifications are required on the north side of the existing Bhavnagar port to develop CNG, Ro-Ro and liquid terminals. Moreover, there is a requirement of dredging in the water channel of the port basin, construction of two lock gates and off-shore infrastructure for CNG transportation, he said.

**INDIA INFRASTRUCTURE FINANCE COMPANY LIMITED**  
(A Government Of India Enterprise)  
Registered Office: 5<sup>th</sup> Floor, Block 2, Plate A & B,  
NBCC Tower, East Kidwai Nagar, New Delhi - 110 023  
CIN : U67190DL2006GO1144520

**Corrigendum to the advertisement**  
With reference to the advertisement for the post of **Chief General Manager (reserved for OBC)** published in Jansatta and Financial Express dated 01/09/2020 and also uploaded on IIFCL website, the last date of receipt of application mentioned in the advertisement may be read as 22.09.2020 instead of 15.09.2020. For further details log on to [www.iifcl.org](http://www.iifcl.org)

**General Manager**

**भारतीय प्रतिभूति और विनियम बोर्ड**  
Securities and Exchange Board of India  
SEBI Bhavan II, Plot No. C-7, 'G' Block, Bandra-Kurla Complex, Bandra(E), Mumbai - 400051

**NISM National Institute of Securities Markets**  
An Educational Initiative by SEBI

**Empanelment of Securities Market Trainers (SMARTs)**

Securities and Exchange Board of India (SEBI) invites applications from eligible persons to be empanelled as Securities Market Trainers (SMARTs) to conduct Investor Awareness Programs.

Details regarding selection criteria, application form, etc. are available on the website <https://www.sebi.gov.in/>, <https://investor.sebi.gov.in> and NISM website <https://nism.ac.in>.

Last date for submission of application is **October 16, 2020.**

Investor Awareness Division, OIAE

**ninecolours**  
NIVAKA FASHIONS LIMITED  
CIN: LS2100WB1983PLC035857  
Registered Office: AA-47, SALT LAKE CITY SEC. 1, BL-AA KOLKATA - 700064.  
Telephone No: 022-61642424, Email Id: [btynidicateltd1983@gmail.com](mailto:btynidicateltd1983@gmail.com), [investors@ninecolours.com](mailto:investors@ninecolours.com)

**Statement of Standalone Unaudited Financial Results for the Quarter ended 30<sup>th</sup> June, 2020**  
(In Rs. LAKHS)

Sl. No.	PARTICULARS	3 months ended		Corresponding 3 months ended in the previous year		Previous year ended	
		30/06/2020	30/06/2019	30/06/2020	30/06/2019	31/03/2020	31/03/2019
1	Total Income from Operations	408.39	142.08	613.27	2155.18		
2	Other Income	0.00	29.82	11.73	101.48		
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	32.26	18.12	(174.36)	(83.69)		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	24.20	13.59	(174.36)	(83.69)		
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	24.20	13.59	(174.36)	(83.69)		
6	Equity Share Capital	1026.9	1026.9	1026.9	1026.9		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	(60.67)	15.00	(99.87)	(84.87)		
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations):						
	1. Basic:	0.02	0.01	0.00	0.00		
	2. Diluted:	0.02	0.01	0.00	0.00		

NOTES:  
1) Above financial result for the quarter ended 30th June, 2020 have been reviewed and the board of directors at their respective meeting held on 14th Sept 2020.  
2) Statutory Auditors have carried out a limited review of these financial result and their report is unqualified.  
3) The above results for the quarter & year ended 31st March, 2020 along with Auditor Report & Declaration has been approved by the Board of Directors of the Company.  
4) The above financials as on 30/06/2020 have been prepared as per the applicability of Ind AS.  
5) Unquoted investments as stated in the financials are valued at cost.  
6) Short term & Long Term Loan & Advances are payable on demand and are valued at cost.  
7) The financial result of the company has been prepared with Ind accounting standards notified in accordance with Ind AS 108 "Operating Segment".  
8) Previous periods figure have been regrouped wherever necessary to conform to the current periods classification.  
For Nivaka Fashions Limited  
Place: Kolkata  
Date: 16.09.2020

**For Nivaka Fashions Limited**  
Sd/-  
Bhavin Jain  
Managing Director

[www.ninecolours.com](http://www.ninecolours.com)

**कार्यालय-नगर निगम, रुड़की, जिला हरिद्वार (उत्तराखण्ड)**  
ई-मेल [nagamigamroorkee@gmail.com](mailto:nagamigamroorkee@gmail.com), Web Site: [www.nagamigamroorkee.org](http://www.nagamigamroorkee.org)

**TENDER NOTICE/RFP** दिनांक-14.09.2020

Nagar Nigam, Roorkee (NNR) proposes to set up "Waste to Energy Plant" for conversion of Municipal Solid Waste into energy by using an Innovative Environmentally Clean Technology (incineration/bio methanation /pyrolysis/ gasification or any other Zero Pollution solution) through competitive bidding process. For this purpose, Nagar Nigam, Roorkee has to select the developer for the project through Two Bid system (Technical and Financial Bid).

The land identified is at Saliyar, Roorkee Dehradun Road at a distance of 5 km. from Roorkee. Under the above two bid system tendering the proposal is requested to the Firms/legal entity whose technology and provisions have been approved by CPCB/SPCB/ any other statutory provisions.

Nagar Nigam Roorkee (NNR) therefore, invites RFP/Tender on Dt. 15-10-2020 from interested eligible bidders possessing required technical and financial capabilities as per the table given in the tender/RFP documents. Tender/RFP can be purchased from Nagar Nigam office by paying a fee of Rs. 23,600 (As. 20,000+18% GST only) through Bank Draft/ RTGS/ Electronic Transfer to the account of Nagar Nigam, Roorkee (A/C Name Nagar Nigam Roorkee, A/c No 50100141423378, IFSC Code HDFC0000657, HDFC Bank Roorkee). The tender document and the details of the RFP/Tender can be downloaded from the web site of Nagar Nigam Roorkee [nagamigamroorkee.org](http://nagamigamroorkee.org) or from [uktenders.gov.in](http://uktenders.gov.in) on Dt. 15-09-2020 to Dt. 15-10-2020.

The NNR intends to short list suitable technically qualified applicants (the "Bidders") who shall be eligible for participation in the opening of the financial Bids, for awarding the Project through competitive bidding (E-Tendering) process with the procedure set out herein. The selected Bidder, who is either a company incorporated under the Companies Act, 1956 or undertakes to incorporate as such prior to execution of the concession agreement (the "Concessionaire") shall be responsible for designing, engineering, finance, procurement, construction, operation and maintenance of the Project under and in accordance with the provisions of a long-term (20 Years) concession agreement (the "Concession Agreement") to be entered into between the Concessionaire and the NNR in the form to be provided by the NNR issued to qualified bidders

Assistant Municipal Commissioner, Nagar Nigam, Roorkee  
Ph No. 7017957854, Email: [nagamigamroorkee@gmail.com](mailto:nagamigamroorkee@gmail.com)  
Web Site: [www.nagamigamroorkee.org](http://www.nagamigamroorkee.org)

**SpiceJet Limited**  
Regd Office : Indira Gandhi International Airport, Terminal 1D, New Delhi 110 037  
CIN: LS1909DL1984PLC288239  
E-mail: [investors@spicejet.com](mailto:investors@spicejet.com) | Website: [www.spicejet.com](http://www.spicejet.com) | Telephone: +91 124 391 3939 | Facsimile: +91 124 391 3844

**Extract of Unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended June 30, 2020**  
(Rupees in millions)

S. No.	Particulars	Standalone				Consolidated			
		Quarter ended		Year ended		Quarter ended		Year ended	
		Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited
		30-Jun-20	31-Mar-20	30-Jun-19	31-Mar-20	30-Jun-20	31-Mar-20	30-Jun-19	31-Mar-20
1	Total income from operations	5,146.9	28,638.6	30,020.7	1,23,586.4	5,210.4	28,670.2	30,028.5	1,23,745.7
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(5,934.1)	(8,070.8)	2,616.7	(9,347.6)	(6,005.2)	(8,162.5)	2,628.9	(9,365.7)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	(5,934.1)	(8,070.8)	2,616.7	(9,347.6)	(6,005.2)	(8,162.5)	2,628.9	(9,365.7)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(5,934.1)	(8,070.8)	2,616.7	(9,347.6)	(6,005.2)	(8,162.5)	2,628.9	(9,365.7)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(5,926.4)	(8,072.6)	2,603.1	(9,380.1)	(5,997.4)	(8,164.3)	2,615.3	(9,398.2)
6	Equity share capital				6,000.8				6,000.8
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the year ended March 31, 2020				(21,793.4)				(21,804.7)
8	Earnings Per Share (of Rs. 10/- each) (not annualized)								
	a) Basic (Rs)	(9.89)	(13.45)	4.36	(15.58)	(10.01)	(13.60)	4.38	(15.61)
	b) Diluted (Rs)	(9.89)	(13.45)	4.36	(15.58)	(10.01)	(13.60)	4.38	(15.61)

Notes:  
1. The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended June 30, 2020, filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The full format of the Unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended June 30, 2020 are available on the Company's website [www.spicejet.com](http://www.spicejet.com) and on the website of the Stock Exchange [www.bseindia.com](http://www.bseindia.com).

Place: Gurugram, Haryana  
Date: September 15, 2020

**For SpiceJet Limited**  
Sd/-  
Ajay Singh  
Chairman and Managing Director

**युनाइटेड इंडिया इन्सुरेन्स कंपनी लिमिटेड**  
**UNITED INDIA INSURANCE COMPANY LTD.**  
(A Government of India Undertaking)

Regd. Office: No.24, Whites Road, Chennai-14 & Head Office: No. 19, Nungambakkam High Rd., IV Lane, Chennai-34  
Toll Free No: 1-800-425-3333 | Email: [customercare@uiic.co.in](mailto:customercare@uiic.co.in) | Website: [www.uiic.co.in](http://www.uiic.co.in)  
IRDAI Registration No.: 545, CIN No. U93090TN193860I000108

**At United India, it's always U before I**

**FINANCIAL RESULTS (STANDALONE) FOR THE YEAR ENDED AS ON 31<sup>ST</sup> MARCH 2020**  
[See Regulation 47(1)(b) of SEBI (LODR) Regulations, 2015 read with IRDAI Circular Reference IRDA / F&A/CIR/LFTD/027/01/2017 dated 30<sup>th</sup> January 2017] (₹ in Lakhs)

Sl. No.	Particulars	Current Year Ending 31.03.2020	Previous Year Ending 31.03.2019	Quarter Ending 31.03.2020	Quarter Ending 31.03.2019
1	Premium Income (Gross)	1751509	1642047	498127	503991
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional &/or Extraordinary items)	(148571)	(187791)	(12709)	16965
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional &/or Extraordinary items)	(148571)	(187791)	(12709)	16965
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional &/or Extraordinary items)	(148585)	(187791)	(12723)	16965
5	Equity Share Capital	20000	15000	20000	15000
6	Reserves (excluding Revaluation Reserve)	131051	279413	131051	279413
7	Earnings Per Share of (₹ 10/- each) (for continuing and discontinued Operations)				
	1. Basic	(99.47)	(126.69)	(99.47)	(126.69)
	2. Diluted	(99.47)	(126.69)	(99.47)	(126.69)

Notes:  
a) This format is modified to reflect the terminology used in the insurance Act/IRDAI Regulations.  
b) The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the company.  
c) Premium income is gross of reinsurance and net of GST.  
d) Net Profit/(Loss) before tax, for the period is Profit before tax as appearing in Profit and Loss Account.  
e) Reserves are excluding Revaluation reserve and fairvalue change account.

**For & On behalf of Board of Directors**  
**GIRISH RADHAKRISHNAN**  
Chairman-cum-Managing Director  
DIN: 08268834

Place: Chennai  
Date: 12.09.2020

**THE SANDESH LIMITED**  
REGD. OFFICE : "SANDESH BHAVAN", LAD SOCIETY ROAD, B.H. VASTRAPUR GAM, R.O. BODAKDEV, AHMEDABAD - 380 054, (GUJ.) | CIN : L22121GJ1943PLC000183

**EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS (FOR THE QUARTER ENDED JUNE 30, 2020) AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS (FOR THE QUARTER ENDED JUNE 30, 2020)**  
(Rs. In Laacs, except earning per share data)

SR. NO.	PARTICULARS	STANDALONE				CONSOLIDATED			
		QUARTER ENDED		YEAR ENDED		QUARTER ENDED		YEAR ENDED	
		June 30, 2020	March 31, 2020	June 30, 2019	March 31, 2020	June 30, 2020	March 31, 2020	June 30, 2019	March 31, 2020
1	Total Income from Operations	4249.26	8242.31	8994.94	34107.21	4290.61	8292.84	9044.43	34321.30
2	Net Profit for the period (before Tax and Exceptional items)	1939.09	1640.79	1971.36	7293.81	2453.09	1726.37	2025.69	7598.15
3	Net Profit for the period before Tax (after Exceptional items)	1938.28	1656.02	1973.75	7388.04	2452.28	1741.60	2028.08	7692.38
4	Net Profit for the period after tax (after Exceptional items)	1434.79	1273.59	1307.46	5836.31	1942.99	1353.10	1360.88	6109.98
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1434.79	1278.68	1307.46	5841.40	1942.99	1357.86	1360.88	6114.74
6	Paid-up Equity Share Capital	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94
7	Reserves excluding Revaluation Reserve	-	-	-	76972.66	-	-	-	77941.50
8	Earnings Per Share (of Rs. 10/- each) (Not Annualised)								
	Basic	18.96	16.83	17.27	77.10	25.67	17.88	17.96	80.72
	Diluted	18.96	16.83	17.27	77.10	25.67	17.88	17.96	80.72

Notes:  
i) The above is an extract of the detailed format of Standalone & Consolidated Unaudited Financial Results (For The Quarter Ended June 30, 2020) filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid Financial Results are available on the Stock Exchange websites ([www.bseindia.com](http://www.bseindia.com)) & [www.nseindia.com](http://www.nseindia.com)) and Company's website ([www.sandesh.com](http://www.sandesh.com)).  
ii) The above results were reviewed by the Audit Committee and thereafter approved at the meeting of the Board of Directors held on September 15, 2020. The same have also been subject to Limited Review by the Statutory Auditors. There are no qualifications in the report issued by auditors.  
iii) The outbreak of COVID - 19 pandemic is causing significant disturbance and slowdown of economic activity. The Company's operation and revenue during the current quarter were impacted due to the COVID - 19. The Company further feels that carrying amount of the asset will be recovered.  
iv) Consolidated Financial Results includes results of Sandesh Digital Private Limited (A wholly owned subsidiary) and Applewoods Estate Private Limited (Associate).  
v) In accordance with Ind AS 108, Operating Segments, the company has disclosed the segment information in the consolidated financial statements.  
vi) Figures for the previous periods have been regrouped / re-arranged, wherever considered necessary.

**For and on behalf of the Board**  
**The Sandesh Limited**  
Sd/-  
Parthiv Patel  
DIN: 00050211  
Managing Director

Place : Ahmedabad  
Date : September 15, 2020

**EMAIL: [investors@grivance@sandesh.com](mailto:investors@grivance@sandesh.com), CONTACT NO. (079) 4000 4000, 4000 4319, FAX NO. (079) 4000 4242, Website: [www.sandesh.com](http://www.sandesh.com)**

